

MARG TECHNO PROJECTS LIMITED

CIN: L69590GJ1993PLC019764

Phone : 99253 61689

Email id : <u>margtechno@gmail.com</u> Website : <u>www.margtechno.com</u>

Date: 11.11.2023

To,

The Manager BSE LIMITED

1st Floor, P. J. Towers,

Dalal Street,

Mumbai- 400001.

Equity Script Code: 540254

To,

The Manager,

Department of Corporate Regulations,

Metropolitan Stock Exchange of India Limited,

205(A), 2nd Floor, Piramal Agastya Corporate Park, Kamani Junction, LBS

Road, Kurla (West), Mumbai - 400070

Equity Script Code: 35404

Sub: Newspaper publication of unaudited Financial Results for the quarter and half year ended September 30, 2023.

Dear Sir/Madam,

Pursuant to Regulation 47(3) of the Securities and Exchange Board of India (Listing Obligations And Disclosure Requirements) Regulations, 2015, please note that the Un-audited financial results of the Company for the quarter and Half Year ended September 30, 2023 were published in

Financial Express - English &

Financial Express - Gujarati

on 11.11.2023 Copies of the same are enclosed for your information and records.

Kindly take the same on your record and oblige.

Thanking you.

Yours faithfully,

For MARG TECHNO- PROJECTS LIMITED

DIVYA SHAH

Company Secretary cum Compliance Officer A-39586

Encl: As above.

Reg. Office: 406, Royal Trade Centre, Opp. Star Bazar, Adajan, Surat -395009. | Toll Free No.: 1800 572 3289



MARG TECHNO PROJECTS LIMITED

CIN: L69590GJ1993PLC019764

Phone : 99253 61689

Email id : <u>margtechno@gmail.com</u> Website : <u>www.margtechno.com</u>

Date: 11.11.2023

To.

The Manager

BSE LIMITED

1st Floor, P. J. Towers,

Dalal Street,

Mumbai- 400001.

Equity Script Code: 540254

To,

The Manager,

Department of Corporate Regulations,

Metropolitan Stock Exchange of India Limited, 205(A), 2nd Floor, Piramal Agastya

Corporate Park, Kamani Junction, LBS

Road, Kurla (West), Mumbai - 400070

Equity Script Code: 35404

Sub: Clarification on un-audited Financial Results for the quarter and half year ended September 30, 2023.

Dear Sir/Madam,

Please note that the Financial Statements of Marg Techno Project Limited Publish in News Paper Dt. 11.11.2023 for the quarter and half year ended September 30, 2023 are unaudited and the figures presented are in lakhs only.

Kindly take the same on your record and oblige.

Thanking you.

Yours faithfully,

For MARG TECHNO- PROJECTS LIMITED

DIVYA SHAH

Company Secretary cum Compliance Officer A-39586

Encl: As above.

Reg. Office: 406, Royal Trade Centre, Opp. Star Bazar, Adajan, Surat -395009. | Toll Free No.: 1800 572 3289



WONDER HOME FINANCE LTD.

WONDER Corp. Office: 620, 6th Floor, North Block, World Trade Park, Malviya Nagar, JLN Road, Jaipur- 302017, TEL: 0141 - 4750000

Demand Notice Under Section 13(2) of Securitisation Act of 2002

As the Loan Account Became NPA therefore the Authorised Officer (AO) Under section 13 (2) Of Securitisation and Reconstruction of Financial Assets And Enforcement of Security Interest Act 2002 had issued 60 day demand notice to the borrower as given in the table According to the Notice if the Borrower does not deposit the amount within 60 days, the amount will be recovered from Auction of the ecurity as given below. As the demand Notice send to the borrower/guarantor has not been served, copy of demand notice has also een affixed on the secured assets as given below. Therefore you the borrower is informed to deposit the loan amount along with future nterest and recovery expense within 60 days, otherwise under the provisins of section 13(4) and 14 of the said Act, the Authorise

Officer is free to take possession of the Security a	as given below.			
Name of the Borrower	Date & Amount of Demand Notice Under Sec. 13(2)	Description of Mortgaged Property		
(1) Sh. Dipakbhai Dahyabhai Solanki (Applicant & Mortgagor) (2) Smt. Magda Ben Dipakbhai Solanki (Co-Applicant) Add : Aashirvadbhai, A-39 Jalaram Nagar, Manjipura-1, Manjipura (Part), Kheda, Nadlad, Bilodra, Gujarat-387320 (3) Rathod Albert Raymund (Guarantor) Add : A-20, Suryoday Nagar, Chhani Road Navayard, Vadodrag Guileatt-390002	Loan Account No LN12038HP22-23007643 08.11.2023, ₹26,44,324.00/- (Rupees Twenty Six Lakh Forty Four Thousand Three	Block/Survey No.267/1//4,Paiki 2Paiki, Khata No 1464, Plot No. A/20,Rudra Residency Near Pramukh Park, Opp. SRP Camp.Nadiad Kapadwanj Road, at Bilodara, Taluka Nadiad, Distt. Kheda, Gujarat-387002. Admeasuring about 908.00 Sq. Feet. As Per Actual North: Road South Plot No. A/19 East: Plot No. A/21 West: Road		

(1) Sh. Laljibhai Saybaji Gawariya S/o Sayabji Manilal Gawariya (Applicant & Mortgagor) (2) Smt. Jamana Ben Lalji Bha Gawariya (Co-Applicant) Add : 4145.Brahmani nagar Society, Ghojariya Mehsana, Gujarat-382825

Demand Notice Date Property No. 7318, Plot No. 17, Survey No. 2510, 09.11.2023 Old Survey No. 1475, Paiki/1, Society Name as Loan Account No LN12035HP20-21003237 "Shree Ram Society", Near Sai Baba Temple, Visanagar Road, Mouje Gozaria, Taluka & Distt. 08.11.2023, ₹6,92,237.50/-Mehsana, Gujarat-382825. Admeasuring about (Rupees Six Lakh Ninety Two 600.00 Sq. Feet. As Per Actual North: Plot No. 18 housand Two Hundred Thirt Seven and Paisa Fifty only) South Plot No. 16 East : Survey No. 1474 West 7.50 Miter Society Road

Date: 10.11.2023, Place: Jaipur

Authorised Officer Wonder Home Finance Ltd.

MARG TECHNO-PROJECTS LIMITED

(CIN: L69590GJ1993PLC019764) Reg. Office: 406, Royal Trade Centre, Opp. Star Bazaar, Adajan, Surat - 395009, Gujarat Contact: 99253 61689

Particulars	Quarter ending /Current Year ending	Year to date Figures/Previous Year ending	Corresponding 3 months ended in the previous year
	Quarter ended	Half Year Ended	Quarter ended
	30-09-2023	30-09-2023	30-09-2023
	(Unaudited)	(Unaudited)	(Unaudited)
Total income from operations (net)	132.17	249.27	139.97
Net Profit / (Loss) from ordinary activities after tax	16.26	23.87	3.26
Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)	16.26	23.87	3.26
Equity Share Capital	600	600	600
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)			
Earnings Per Share (before extraordinary items) (of` 10/- each)			
Basic :	0.27	0.40	0.05
Diluted:	0.27	0.40	0.05
Earnings Per Share (after extraordinary items) (of `10/- each)	0.27	0.40	0.05
Basic :	0.27	0.40	0.05
Diluted:	0.27	0.40	0.05

Note: The above is an extract of the detailed format of financial results for the quarter ended september, 30, 2023, fried with the Stock Exchanges under Regulation 33 and Regulation 52 of SeBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of financial results for the quarter and Half Year ended September 30, 2023 is available on Stock Exchange website (www.bseindia.com and www.msei.in) and on the website of the compan-(https://margtechno.com/).

Place: Surat Date: 10.11.2023 For and on behalf of Board of Directors For MARG TECHNO-PROJECTS LIMITED Sd/- Akhil Nair Managing Director DIN: 07706503

SILVER TOUCH TECHNOLOGIES LTD

CIN: L72200GJ1995PLC024465

Regd. Off: 2nd Floor, Saffron, Nr. Panchwati Circle, Ambawadi Ahmedabad-380006 Gujarat Tel No: +91 79 4002 2770 | Email : cs@silvertouch.com | Website: www.silvertouch.com EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR

THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2023

					(₹	In Lakhs E	xcept EPS
01			Quarter End	ed	Half Ye	Year Ended	
SI No.	Particulars	30.09.2023	30.06.2023	30.09.2022	30.09.2023	30.09.2022	31.03.2023
10.		(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Audited)
1	Total income	4710.65	3969.99	3830.29	8680.64	6936.74	15484.61
2	Net Profit / (Loss) for the period after tax	100000000000000000000000000000000000000	A 27 Company of		//www.commons	1444 45 51 1551	100000000000000000000000000000000000000
	(after Extraordinary items)	368.92	152.98	231.55	521.90	340.42	905.54
3	Total Comprehensive Income	374.19	147.44	224.49	521.62	367.07	928.05
4	Paid-up Equity Share Capital (Face Value of the shares Rs 10/-)	1268.10	1268.10	1268.10	1268.10	1268.10	1268.10
		1200.10	1200.10	1200.10	1200.10	1200.10	1200.10
5	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)				8585.23	7501.72	8063.61
6	Earnings Per Share (after extraordinary items) (of Rs 10 /- each)						
	Basic:	2.9	1.2	1.83	4.12	2.68	7.14
	Diluted :	2.9	1.2	1.83	4.12	2.68	7.14

Directors in their meeting held on 10th November, 2023. 2. The above is an extract of the detailed format of quarter and half year ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements tegulations, 2015. The full format of the quarter and half year ended Financial Results are available on the Stock Exchange websites i. NSE (www.nseindia.com), BSE (www.bseindia.com) and on the Company's website (www.silvertouch.com) 3. The financial results for the quarter and half year ended September 30,2023 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (IND AS) prescribed under section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicat

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2023

٥,			Quarter End	ed	Half Yea	ar Ended	Year Ended
SI No.	Particulars	30.09.2023	30.06.2023	30.09.2022	30.09.2023	30.09.2022	31.03.2023
10.		(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Audited)
1	Total income	5175.31	4339.11	4235.90	9514.41	7629.82	16632.27
	Net Profit / (Loss) for the period after tax						
6	(after Extraordinary items)	360.52	147.06	214.31	507.57	345.29	971.30
1	Total Comprehensive Income	369.84	137.17	207.26	507.01	371.94	1159.06
١	Paid-up Equity Share Capital (Face Value of the shares Rs 10/-)	1268.10	1268.10	1268.10	1268.10	1268.10	1268.10
o common	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	NTC-tanaluses	000000000000000000000000000000000000000		8746.05	7287.99	8243.27
	Earnings Per Share (after extraordinary items) (of Rs 10 /- each)						
	Basic:	2.84	1.15	1.69	4.00	2.72	7.66
	Diluted :	2.84	1.15	1.69	4.00	2.72	7.66

lote: 1. The above Consolidated results have been reviewed by Audit Committee and have been subsequenty approved by the Board or Directors in their meeting held on 10th November, 2023. 2. The above is an extract of the detailed format of quarter and half year ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements Regulations, 2015. The full format of the quarter and half year ended Financial Results are available on the Stock Exchange websites i.eNSE (www.nseindia.com), BSE (www.bseindia.com) and on the Company's website (www.silvertouch.com) 3. The financial results for the quarter and half year ended September 30,2023 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (IND AS) prescribed under section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable. For Silver Touch Technologies Limited

Date: 10/11/2023 Vipul Thakka (Managing Director) Place: Ahmedabad

[₹ in Lakhs]

්ට GSPL India Gasnet Limited

CIN: U40200GJ2011SGC067449 Corp. Office: "GSPL Bhavan, Sector-26, Gandhinagar-382 028" Tel: +91-79-23268500 Fax: +91-79-23268875 Website: www.gspcgroup.com

NOTICE INVITING TENDER

GSPL India Gasnet Limited (GIGL), Joint venture Company promoted by GSPL IOCL, BPCL and HPCL is operating a gas grid, to facilitate gas transmission from supply points to demand centres across Gujarat, Rajasthan, Punjab and Haryana. GIGL invites bids from reputed companies for tender for "Placement of Insurance for GIGL" vide "Single Stage, Two-Part" bidding process through e-tendering on (n)procure portal.

Date of tender Upload on (n)procure portal - 11.11.2023

Interested bidders can bid, view /download details from http://gigl.nprocure.com/ Details can also be viewed on GIGL website. All future announ this tender shall be published on (n)Procure Portal ONLY.

GIGL reserves the right to cancel and/or alter bidding process at any stage without assigning any reason. GIGL also reserves the right to reject any or all of the bids received at its discretion, without assigning any reasons whatsoever.

POSSESSION NOTICE (for immovable property)

The undersigned being the Authorized Officer of INDIABULLS HOUSING FINANCE LIMITED (CIN:L65922DL2005PLC136029) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice dated 13.07.2023 calling upon the Borrower(s) MAHESHBHAI S. BUHA ALIAS MAHESHBHAI SAVJIBHAI BUHA ALIAS BUHA MAHESHBHAI SAVJIBHAI AND KAILASBEN MAHESHBHAI BUHA ALIAS KAILASBEN M. BUHA ALIAS BUHA KAILASBEN MAHESHBHAI to repay the amount mentioned in the Notice being Rs. 16,12,305.37 (Rupees Sixteen Lakhs Twelve Thousand Three Hundred Five And Palse Thirty Seven Only) against Loan Account No. HDHLSUR00488316 (Earlier LAN Code 00009844 of DHFL) as on 06.07.2023 and interest thereon within 60 days from the date of receipt of the said Notic

The Borrower(s) having failed to repay the amount. Notice is hereby given to the Borrower(s) and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on 06.11.2023.

The Borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of INDIABULLS HOUSING FINANCE LIMITED for an amount of Rs. 16,12,305.37/- (Rupees Sixteen Lakh Twelve Thousand Three Hundred Five And Paise Thirty Seven Only) as on 06.07.2023 and interest thereon

The Borrowers' attention is invited to provisions of Sub-Section (8) of Section 13 of the Act in respect of time available, to redeem the Secured Assets

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

ALL THAT PIECE AND PARCEL OF PROPERTY BEARING NON-AGRICULTURAL PLOT OF LAND IN MOUJE KAMREJ, SURAT LYING AND BEING LAND BEARING REVENUE SURVEY NO. 140, BLOCK NO. 139, PAIKI PLOT NO. 49 TO 59. KNOWN AS "SAMARPAN TOWNSHIP" PAIKI BUILDING -A 4TH FLOOR, FLAT NO. 408, SUPER BUILT UP AREA ADMEASURING 82.06 SQ. MTS. 883.00 SQ. FTS., BUILT UP ADMEASURING 52.04 SQ. MTS. I.E. 560.00 SQ. FTS., AT REGISTRATION DISTRICT AND SUB-DISTRICT KAMREJ AND DISTRICT SURATAND BOUNDED AS UNDER:

EAST : ADJOINING BUILDING B

WEST : ADJOINING PASSAGE AND FLAT NO. A/406 NORTH : ADJOINING ROAD

SOUTH: ADJOINING FLAT NO. A/401

Date: 06.11.2023

INDIABULLS HOUSING FINANCE LIMITED Place: SURAT



Advait Infratech Limited

CIN: L45201GJ2010PLC059878

Registered Office: A-801 to 803, Sankalp Iconic Tower, Iscon Temple Cross Road, S.G.Highway, Ahmedabad-380054. Phone: +91 079 4895 6677 • Email ID: cs@advaitinfra.com • Website: www.advaitinfra.com

	Standalone					Consolidated				
Particulars								Half Year ended 30th September		Year ended 31st March
	2023 Unaudited	2022 Unaudited & Restated	2023 Unaudited	2022 Unaudited & Restated	2023 Audited & Restated	2023 Unaudited	2022 Unaudited & Restated	2023 Unaudited	2022 Unaudited & Restated	2023 Audited & Restated
Total Income from Operations	4,797.87	2,793.82	7,522.02	3,706.84	10,306.66	4,894.83	2,800.36	7,640.41	3,773.42	10,420.52
Profit/ (Loss) before exceptional and extraordinary items and taxes	665.17	317.42	869.61	482.72	1,353.42	716.55	244.19	921.24	412.52	1,197.28
Profit / (Loss) before taxes (after exceptional and extra ordinery Items)	665.17	317.42	869.61	482.72	1,353.42	716.55	244.19	921.24	412.52	1,197.28
Profit / (Loss) after taxes(after exceptional and extra ordinery Items)	498.45	243.64	637.72	375.47	1,000.09	549.83	170.41	689.35	305.27	843.96
Total Comperhensive Profit/ (Loss) for the period	0.04	2.95	0.63	5.90	11.80	0.04	2.95	0.63	5.90	11.80
Equity Share Capital [Face value of Rs. 10/- each]	1,020.00	510.00	1,020.00	510.00	1,020.00	1,020.00	510.00	1,020.00	510.00	1,020.00
Reserve [Excluding revaluation reserve]	-	1,6			4,182.65	-	-	-	je	3,564.35
Basic Earning per share (In Rs.)	4.89	9.80	6.25	7.36	9.80	5.39	3.34	6.76	5.99	8.27
Diluted Earning per share (In Rs.)	4.89	9.80	6.25	7.36	9.80	5.39	3.34	6.76	5.99	8.27
	Total Income from Operations Profit/ (Loss) before exceptional and extraordinary items and taxes Profit / (Loss) before taxes (after exceptional and extra ordinery Items) Profit / (Loss) after taxes(after exceptional and extra ordinery Items) Total Comperhensive Profit/ (Loss) for the period Equity Share Capital [Face value of Rs. 10/- each] Reserve [Excluding revaluation reserve] Basic Earning per share (In Rs.)	Particulars 30th Se 2023 UnaudIted Total Income from Operations Profit/ (Loss) before exceptional and extraordinary items and taxes Profit / (Loss) before taxes (after exceptional and extra ordinery Items) Profit / (Loss) after taxes(after exceptional and extra ordinery Items) Total Comperhensive Profit/ (Loss) for the period Equity Share Capital [Face value of Rs. 10/- each] Reserve [Excluding revaluation reserve] - Basic Earning per share (In Rs.) 4,797.87 465.17 665.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 675.17 67	Total Income from Operations Profit/ (Loss) before exceptional and extraordinary items and taxes Profit / (Loss) before taxes (after exceptional and extra ordinery Items) Profit / (Loss) after taxes (after exceptional and extra ordinery Items) Profit / (Loss) after taxes (after exceptional and extra ordinery Items) Total Comperhensive Profit/ (Loss) for the period Equity Share Capital [Face value of Rs. 10/- each] Reserve [Excluding revaluation reserve] Basic Earning per share (In Rs.) 4,797.87 4,797.87 2,793.82 665.17 317.42 243.64 243.64 243.64 2.95 1,020.00 510.00	Particulars Quarter ended 30th September 30th September 2023 Unaudited & Restated & Resta	Particulars Quarter ended 30th September 2023 Unaudited & Restated & R	Particulars	Particulars	Particulars	Particulars	Particulars Particulars

Notes:

- 1. The above is an extract of the details format of quarterly and half yearly ended financial results as on 30th september, 2023 filed with the Stock Exchange under regulations 33 of the SEBI [LODR] Regulations, 2015. The full format of the Financial Results are available on the Stock Exchange website [www.bseindia.com] and on the company website [www.advaitinfra.com].
- 2. The company have adopted IndAS which are applicable form 1st April, 2023. Accordingly company's financial statements have been restated as on 31st March, 2023 as per The Indian
- Accounting Standard (IndAS), as notified under section 133 of The Companies Act, 2013. 3. Figures have been re-grouped/re-classified to make them comparable to the figures wherever necessary.
- 4. The above unaudited results were reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 9th November, 2023

For and on behalf of the Board of Directors of Advait Infratech Limited

Shalin Sheth Managing Director DIN: 02911544



Corporate Indentity Number: L35999GJ1982PLC005203 Regd. Office: Baroda - Godhra Highway, Kalol, District Panchmahal, Pin Code - 389 330, Gujarat | Tel: 02676 - 270600, Fax: 02676 - 235524 Website: www.setcoauto.com | Email: investor.relations@setcoauto.com

Sr.	Particulars	Quarte	r Ended	Half yea	ar Ended	Year Ended
		30-Sep-23	30-Sep-22	30-Sep-23	30-Sep-22	31-Mar-2
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total income from operations	14,574	11,574	29,091	27,376	54,557
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(4,062)	(4,396)	(7,757)	(7,206)	(14,842)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(4,062)	(4,396)	(7,757)	(7,206)	(16,115
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(4,062)	(4,387)	(7,748)	(7,197)	(19,226
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive	2500 D.C	01/2 20	0550 3	\$500 TX	(0250)
	Income (after tax)]	(4,013)	(4,513)	(7,734)	(7,332)	(19,038
6	Paid-up Equity Share Capital (F.V. of ₹ 2/- each)	2,675	2,675	2,675	2,675	2,67
7	Other Equity	7.			7	(45,747
8	Earnings Per Share (F.V. of ₹ 2/- each)					
	Basic	(2.54)	(2.77)	(4.86)	(4.57)	(11.40
	Diluted	(2.54)	(2.77)	(4.86)	(4.57)	(11.40

3 Net Profit / (Loss) for the period after tax NOTES:

1) The Financial Results for the quarter and half year ended September 30, 2023 were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company in their respective meetings held on November 10, 2023.
2) The above is an extract of the detailed format of financial results for the quarter and half year ended September 30, 2022 filed with the Stock Exchange under regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The detailed format of the financial results for the quarter and half year ended September 30, 2023 are available on the company's website (www.setcoauto.com) and Stock Exchange

3) Previous period figures have been regrouped/rearranged wherever considered necessary.

The key Standalone financial information of the Company is as under:

Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/o

Sr. Particulars

Total income from operations

Extraordinary items)

For and on behalf of the Board Harish Sheti anaging Director DIN: 01434459

Half year Ended

(22)

(22)

dited) (Unaudited)

0-Sep-23 30-Sep-22 31-Mar-22

146

114

146

(881)

Authorised Office

Date : November 10, 2023

Sadbhav

Place: Ahmedabad

Date: 11th November, 2023

SADBHAV ENGINEERING LIMITED

CIN: L45400GJ1988PLC011322 Regd office: "Sadbhav House", Opp. Law Garden Police Chowki, Ellisbridge, Ahmedabad - 380006 Phone: 079-40400400, Fax: 079-40400444, Email:- selinfo@sadbhav.co.in Web:- www.sadbhaveng.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS (STANDALONE & CONSOLIDATED) FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2023

												(ns	in Lakns)
	20 E S		Standalone					Consolidated					
Sr No	Particulars Particulars	Quarter ended		Six Mont	Six Months Ended (Audited)		and the second s			Six Mont	hs Ended	Year ended (Audited)	
		30-09-2023	30-06-2023	30-09-2022	30-09-2023	30-09-2022	31-03-2023	30-09-2023	30-06-2023	30-09-2022	30-09-2023	30-09-2022	31-03-2023
1	Total Income from operations (net)	21,883.60	40,483.39	21,453.83	62,366.99	48,470.63	88,917.28	43,835.42	71,116.23	41,831.15	1,14,951.66	91,880.53	1,77,693.69
2	Net Profit/(Loss) for the period (before Tax and Exceptional items)	(561.45)	426.58	61.90	(134.87)	(2,174.68)	(31,895.69)	(2,209.77)	2,672.39	(2,771.40)	462.62	(15,725.90)	(34,450.81)
3	Net Profit/(Loss) for the period before Tax (After Exceptional items)	(56.08)	633.62	(1,144.04)	577.54	(3,380.62)	(34,386.35)	(30,157.36)	(376.47)	(37,833.63)	(30,533.83)	(60,617.02)	(71,333.95)
4	Net Profit/(Loss) for the period after Tax (After Exceptional items)	(321.75)	105.57	(1,181.93)	(216.38)	(3,412.69)	(34,386.35)	(29,281.13)	(1,630.92)	(37,327.63)	(30,912.05)	(60,517.79)	(69,938.98)
5	Total comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	(326.46)	105.37	(1,178.30)	(221.09)	(3,409.06)	(34,648.38)	(29,285.84)	(1,630.92)	(37,312.40)	(30,916.76)	(60,502.56)	(69,900.57)
6	Paid up Equity Share Capital (Face value of Re.1/- each)	1,715.71	1,715.71	1,715.71	1,715.71	1,715.71	1,715.71	1,715.71	1,715.71	1,715.71	1,715.71	1,715.71	1,715.71
7	Reserve (excluding Revaluation Reserves) as per Balance sheet of previous accounting year				1,10,327.17	1,37,727.78	1,06,516.11				10,871.43	17,621.55	15807.24
8	Networth				1,12,042.88	1,39,443.49	1,08,231.82				12,587.14	19,337.26	17522.95
9	"Earnings Per Share (of Re. 1/- each) (for continuing and discontinued operations) - (*not annualized)"	-0.19*	0.06*	-0.69*	-0.13*	-1.99*	-20.19	-12.25*	-0.6*	-15.45*	-12.85*	-25.17*	-34.34
	Basic and Diluted	-0.19*	0.06*	-0.69*	-0.13*	-1.99*	-20.19	-12.25*	-0.6*	-15.45*	-12.85*	-25.17*	-34.34

Notes:

Place: Ahmedabad

Date: 09/11/2023

The above is an extract of the detailed format of quarterly and half yearly Financial Resultes filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchanges website (www.bseindia.com and www.nseindia.com) and on the Company website (www.sadbhaveng.com)

2 The above results were reviewed by the Audit Committee and were approved & taken on record by the Board of Directors at their meeting held on November 09, 2023.

For Sadbhav Engineering Limited

Sd/-

Shashin V. Patel Chairman & Managing Director (DIN: 00048328)

GSPL India Transco Limited

CIN: U40200GJ2011SGC067450 Regd Office: GSPC Bhavan, Sector-11, Gandhinagar-382010, Gujarat, India Tel.: +91-79-23268500/600 Fax: +91-79-23268506 Website: www.gspcgroup.com

30-Sep-23 30-Sep-22

(7)

NOTICE INVITING TENDER GSPL India Transco Ltd. (GITL) a Joint Venture of GSPL, IOCL, BPCL and HPCL is operating

a pipeline section of 366 km (approx.) from Kunchanapalli (West Godavari, AP) to Ramagundam Fertilizers & Chemicals Ltd (RFCL), Ramagundam (Telangana) to facilitati gas transmission from supply points to demand centres in Andhra Pradesh and Telangana GITL invites quotes for premium from reputed General Insurance Companies fo "Placement of Insurance for GITL" vide "Single Stage, Two-Part" bidding process through e-tendering on (n) procure portal.

Date of tender Upload on www.nprocure.com :- 11/11/2023

Interested bidders can view /download details from (https://gitl.nprocure.com Details can also be viewed on GITL website (http://gspcgroup.com/GITL/) All future announcement related to this tender shall be published on the sa

GITL reserves the right to cancel and/or alter bidding process at any stage with assigning any reason. GITL also reserves the right to reject any or all of the bids received at its discretion, without assigning any reasons whatsoever.

JASON DEKOR PRIVATE LIMITED

CIN: U74994GJ2003PTC042695 Regd Office: G-9 Mahaveer Towers, Nr. Mahalaxmi Cross Roads, Paldi, Ahmedabad 380007 Corres. Add.: 110, Atria - B, Sargasan Circle, Gandhinagar, Gujarat - 382421

E-Mail: info@jasondekor.com | Correspondence email: jasondekor.cirp@gmail.com NOTICE OF 20" ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 20th Annual General Meeting of the company will be held at 03.00 P.M. on Tuesday, 05th December, 2023 through Video Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM). The Notice setting out the business to be transacted in AGM together with the Annual Report of the Company for the Financial Year 2022-23 has been sent to the members at their registered email id, those members whose email id is not registered with the company are requested to register by sending request mail to the Company to jasondekor.cirp@gmail.com. The Annua report is also available on the Company Website www.cmageorgesamuel.com. The requirement of sending physical copy of the notice of the AGM and Annual report to the member have been dispensed with the relevant MCA Circulars. The details of the said meeting are also available on the website of the resolution

professional at www.cmageorgesamuel.com

For Jason Dekor Private Limited (In CIRP) Sd/-


George Samuel (Resolution Professional) Place: Gandhinagar IP Reg. No: IBBI/IPA-003/IP-N00043/2017-2018/10319











Bank of Baroda

| बैंक ऑफ़ बड़ौदा | से822 १९ शाफा : प्लोट नं, 320/321, ध-४, Rank of Ramda | से822-१९, गांधीनगर-3८२०१९. Ph. 079-23221503 Email : dbgnag@bankofbaroda.co.in

સિક્યુરીટાઇડેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એનફોર્સગેન્ટ ઓફ સિક્યુરીટી એક્ટ ૨૦૦૨ની કલગ ૧૩(૨) ફેકળ નોટીસ

(૧) મે. મિલ્ય કેરી પ્રોકક્ટસ, માલિક - શ્રી મિલન તરૂણભાઈ કોંઘીયા (ઉદ્યારકર્તા), ડી-૧૦૨, રિડિ ટાવર, લોટસ સ્કુલ પાસે, જોઇપુર ગામ રોક, સેટેલાઇટ, અમદાવાદ-૧૫, અને અન્ય : ઇ-૫૦૨, રિડિ ટાવર, લોટસ સ્કુલ પાસે, જોઇપુર ગામ રોક, સેટેલાઇટ, અમદાવાદ-૧૫, અને અન્ય : ૧૩, સંખેશર ઇન્સ્ટ્રીયલ એસ્ટેટ, કર્ણાવતી કેરી સામે, તાજપુર રોક, ચાંગોદર, સાણાંદ, અમદાવાદ.

પ્રકાર સુવિદ્યાનો	મંજૂર કરેલ	વ્યાજનો દર	બાકી લ્ફેસાં	બાંફેઘરીવાળી મિલકતો / અસ્ક્રમામતોનું વર્શન						
ટર્મ લોન મશીનરી	રૂા. 21.46	11.60%	Şı. 19,85,908/-	ગીરવે ગુકેલ મશીન ક્રમ વિગતો		ો કોષ્ટકમાં જણાવેલ વિગતો મુજબ વિગતો				
એકાઉન્ટ નંબર 7283060 0001419	агы		(એક રા. ઓગણીસ લાખ પંચ્ચારી ફજાર નવસો આઠ પૂરા + નાણાની ચુકવણી ન થાય ત્યાં સુધીનું બ્યાજ	3 नित्व पाश्यक्ष वर्ष । HP 4 नित्व पाश्यक्ष वर्ष कर 2000 LPH 5 नित्व SS वीर्टीन्स SS 304	14 15	પનીર કોગ્યુલેશન ડગ્પ ટેંક				

- ર. આપ જાણો છો કે, આપ તા. ૨૮.૦૮.૨૦૨૩ થી લોનના ધ્યાજની ચૂકવણીમાં નિષ્ફળ ગયા છો. આપ તા. ૨૮.૦૮.૨૦૨૩ ના રોજના જમા કરાવવાના અને તે પછી જમા કરાવવાના ટર્મ લોન અને કીમાન્ક લોન ના હપ્તાની ચૂકવણીમાં પણ નિષ્ફળ ગયા છો. 3. આપ લોનની ચૂકવણીમાં નિષ્ફળ જવાના પરિણામે રીકર્વ બેંક ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન અને દિશાસૂચન પ્રમાણે તા. ૨૮.૦૮.૨૦૨૩ થી અસરમાં આવે તે રીતે આપનું એકાઉન્ટને નોન-પહોંમિંગ એસેટ્સ તરીકે ગણી લીધેલ છે. અમારી વારંવાર વિનંતિ અને માંગણા કરવા છતા પણ આપે આપના બાકી લોન અને તેના ઉપરના વ્યાજ સહિતના નાણાં ચૂકવ્યા નથી.
- . ઉપરોક્ત જણાવેલ કારણોને લીધે બેંક દ્વારા ઉપરોક્ત કાયદાની કલમ ૧૩(૨) કેઠળ આપને નોટીસ આપીને જણાવવાનું કે બેંકે આપેલ લોન સુવિધા સંપૂર્ણ બાકી રહેણાં રૂમ. ૧૬,૮૫,૯૦૮/- ઉપરાંત વ્યાજ (એક રૂમ. ઓગણીસ લાખ પંચ્ચાસી ક્યાર નવસો અંક પૂરા) સાથે તા. ૨૮.૦૮.૨૦૧૩ થી શરૂ કરીને બાકી રહેણાંની સંપૂર્ણ ચૂકવણી ના થાય ત્યાં સુધીનું ન લગાડેલ વ્યાજ સકીતની રકમ આ નોટીસ થી ૬૦ દિવસમાં પરત ચૂકવી દેવા. જે તેમ કરવામાં નિષ્ફળ જશો તો બેંકને મળેલ સિક્યુરીટાઇકેશન એન્ડ રીકન્સ્ટ્રેક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ની કલમ ૧૩(૪) ઢેઠળ સત્તાની રૂએ ઉપરોક્ત બાંઢેઘરીયાળી મિલકત સામે આપના સંપૂર્ણ જોખમે અને ખર્ચે પગલા લેવામાં આવશે જેની નોંધ લેવી.
- આવેલ કર્મા લાય લેવા. 1. નોંધવાનું કે લીધેલ દરેક ધિરાણ સુવિધાના નાણાંની ચૂકવણી ન થાય ત્યાં સુધીની રકમ ઉપર નોંધ-૧ માં જણાવેલ દરે વ્યાજની ગણતરી ચાલુ રકેશે. 1. નોંધ-૧ માં જણાવ્યા મુજબ આપે વિધિધ મિલકતોને બોફેધરીમાં મુકી લિધેલ સલામત ધિરાણ સુવિધાની ચુકવણીમાં નિષ્ફળ ગયા ફોવાથી તમારૂ ખાતુ એનપીએ શઈ ગયેલ છે. આપને જણાવવાનું કે ઉપરોક્ત કાયદાની કલમ ૧૩(૨) માં જણાવ્યા મુજબ બેંકની અગાઉથી મંજૂરી વગર સલામત મિલકતને વેચાણ, લીઝ અથવા અન્ય કોઈ રીતે (સામાન્ય રીતે અન્ય કોઈ વ્યવસાય લક્ષી) તબદીલ કરવા માટે મનાઈ કરવામાં આવે છે. વધુમાં જણાવવાનું કે ઉપરોક્ત કાયદાની કલમ ૧૩(૧૩) માં ઉપર જણાવેલ વિગતોની અવગણના કરશો તો તે ઉપરોક્ત કાયદાની કલમ ૨૯ હેઠળ દંદનીય અપરાધ ગણાશે.
- s. સરફેસી કાયદાની કલમ ૧૩(૮) દેઠળ આપને ખાસ જણાવવાનું કે આપેલ સમયમર્ચાદામાં જો આપ આપની બેંકની સંપૂર્ણ જવાબદારી જેમાં સામેલ છે, બેંકના બાકી લ્હેણાં સાથે લાગુ પડતા વ્યાજ, તમામ ખર્ચ, ચાર્જીસ સહિત નાણાંની સંપૂર્ણ ચૂકવણી ના થાય ત્યાં સુધીની રકમ જમા નહીં કરાવીને તમારી સલામત મિલકત પાછી નહીં મેળવો તો તમારો આ સલામત મિલકતને પાછો મેળવવાનો અધિકાર લીઝ, વેચાણ કે સોંપણીની જાહેર હરાજીની નોટીસ અથવા ઓફરો અથવા જાહેર કે ખાનગી દ્રીટી દ્વારા ઢેન્ડર પ્રસિધ્ધ તારીખ સુધી જ ઉપલબ્ધ રહેશે. નોંધ લેવાની કે નોટીસ પ્રસિધ્ધ થયા બાદ સલામત મિલવનને પાણી મેળવવાનો તમારો અધિકારી ઉપલબ્ધ રહેશે નહીં.
- . અહીં એ જણાવવાનું કે બેંક પાસે અન્ય કોઈ કારણ કે ઉપાય ન રહેતા આ નોટીસ કોઈપણ પૂર્વગ્રહ કે પક્ષપાત વગર કોઈનો અધિકાર જતો કર્યા વગર તેના

બાકી લ્હેણાં સંદર્ભે માટે અન્ય કોઈ ડિમાન્ડ આપ્યા વગર જારી કરવામાં આવી છે.

તારીખ : ૦૯.૧૧.૨૦૨૩ સ્થળ : ગાંધીનગર અધિકૃત અધિકારી – સુનીલ કુમાર સિંઘ

parmaX PARMAX PHARMA LIMITED

Reg. off: Plot No. 20, Rajkot Gondal National Highway No.27 Hadamtala, Tal. Kotda Sangani, Dist. Rajkot (Gujarat) - 360311. INDIA (CIN: L24231GJ1994PLC023504 Web: www.parmaxpharma.com, E-mail - info@parmaxpharma.com)

					(Rs.	. In Lakh)
Sr. No.	Particulars	Quarter Ended 30/09/2023	Quarter Ended (30/06/2022)	Quarter Ended (30/09/2022)	Half year Ended (30/09/2023)	Half year Ended (30/09/2022)
	(Refer Notes Below)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Total income from operations (net)	407.74	141.38	214.15	549.12	370.53
2	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and / or Extraordinary items)	-136,84	-117.89	-70.26	-254.73	-202.06
3	Net Profit / (Loss) for the period before tax (After Exceptional and / or Extraordinary items)	-136.84	-117.89	-70.26	-254.73	-202.06
4	Net Profit / (Loss) for the period After tax (After Exceptional and / or Extraordinary items)	-136.84	-117.89	-70.26	-254.73	-202.06
5	Total Comprehensive Income for the period [Comprising Profit (Loss) (after tax) and Other comprehensive Income (after tax)]	-136.84	-117.89	-70.26	-254.73	-202.06
6	Equity Share Capital	374.13	374.13	374.13	374.13	374.13
7	Reserves (excluding Revaluation Reserve as shown in the balance Sheet of previous year)		9€0	-	=	
8	Earning Per Share (before extraordinary items)(of Rs.10/- each) Basic EPS	-3.66	-3,15	-1.88	-6.81	-5.40

Note: The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com) & on Company's website (www.parmaxpharma.com)

Place : Hadamtala

Diluted EPS

For, Parmax Pharma Limited

Date: 10th November, 2023

Umang Alkesh Gosalia Managing Director Din No.: 05153830

(Rs. In Lacs)

-1.42

DYNEMIC

DYNEMIC PRODUCTS LIMITED

Regd Office: B-301 Satyamev Complex-1, Opposite Gujarat High Court, S.G. Highway, Sola, Ahmedabad-380060 Email: info@dynemic.com Tel. No.: 079-27663071/76 Fax No.: 079-27662176

CIN - L24100GJ1990PLC013886 Website: www.dynemic.com **EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS** FOR THE QUARTER ENDED ON 30th SEPTEMBER, 2023

Particulars	Qua En	Half Year Ended	
	30-09-2023	30-09-2022	30-09-2023
	Unaudited	Unaudited	Unaudited
Total Income from Operations	6538.93	8440.67	13354.68
Net Profit / (Loss) for the period (before exceptional and extraordinary items and tax)	-379.75	97.59	-108.96
Net Profit / (Loss) for the period before extraordinary items & tax (after exceptional items)	-379.75	97.39	-108.98
Net Profit / (Loss) for the period after tax (after exceptional and extraordinary items)	-359.22	96.76	-167.94
Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-359.22	96.76	-167.94
Equity Share Capital	1203.63	1151.13	1203.63
Earnings Per Share (of Face Value of Rs. 10/- each)	-3.03	0.84	-1.42

Notes

Basic & Diluted Earning Per Share (after extra ordinary items) (of Face Value of Rs. 10/- each)

Details of the following items on Standalone Basis			(Rs. In Lacs)
Particulars	Qua En	Half Year Ended	
	30-09-2023	30-09-2022	30-09-2023
	Unaudited	Unaudited	Unaudited
Turnover	6474.79	8123.99	13089.71
Profit Before Tax	-384.66	94.66	-125.17
Profit After Tax	-362.88	94.66	-180.05
Total Comprehensive Income for the period(after tax)]	-362.88	94.66	-180.05

-3.03

0.84

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Quarterly Financial results are available on Company's website www.dynemic.com and on Stock Exchange's website www.bseindia.com and www.nseindia.com.

For Dynemic Products Limited Place: Ahmedabad Bhagwandas K Patel Date: 10/11/2023 **Managing Director**



शाजाः નવાવાકજ શાખા, **અમદાવાદ**

સરફેસી કાયદા ૨૦૦૨ ની ક્લમ ૧૩(૨) હેઠળ નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે નીચેના ઉધારકર્તા **૧. ત્રી જીતેન્દ્ર અશોકભાઈ દરજી (કરજદાર અને ગીરોદાર),** તેમણે મેળવેલી ધિરાણ સવલતો જેમ કે HOME LOAN બેંક માંથી લીધેલ **૧. ત્રી જીતેન્દ્ર અશોકભાઈ દરજી (કરજદાર અને ગીરોદાર),** ના નામે લીધેલી જેની મૂળ રકમ અને વ્યાજ ભરવામાં કસૂટ કરેલ છે અને તેમની લીન નોન પટકોર્મિંગ એસેટ (એનપીએ) વર્ગોકૂત કરવામાં આવી છે. તેમને નોટીસ સિક્યુરીટાઇપ્રેશન અને રીકન્બ્ટૂડિશન ઓફ ફાચનાન્સીચલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એકટ – ૨૦૦૨ ની કલમ ૧૩(૨) અંતર્ગત તેમના છેલા અને જાણીતા સરનામા ઉપર પાઠવવામાં આવેલ પરંતુ તે "Loit" 8 "Not Known" રીમાર્ક સાથે પરત થયેલ છે. તેથી આ જાહેર નોટીસ મારફતે જણ કરવામાં આવે છે.

			वदास्य तानु नाम	अव सरवानु		
૧) રહેણાંકઃ ટે		૨, ૧૪, ઓમ શાં	તિનગર, મકરબા રોક	5, વેજલપુર, અમદાવ , સાણંદ, અમદાવાદ.		
		LO	AN DETAILS		Demand	Due Amount
લોનનો પ્રકાર	એકાઉન્ટ નંબર	લોનની રક્રમ	43 8185	30.09.2023	Notice Date	Rs. 664378.08 dl.
	वाकातक्ट जागर	उन्द्र जलर साजना रक्ष्य		સુધીની બાકી રકમ	31/07/2023	30/0७/२०२३ सधी न
HOME	3918912277	589467/-	7.900% p.a.	664378.08	Date of NPA	લ્થાજ
LOAN	55.057((7776.0)		SCHOOL STATE		29/07/2023	
	TOTAL	589467/-				Rs. 664378.08

ગૌરવે મુકેલ મિલકતનું વર્ધન ગૌરવે મુકેલ મિલકતનું વર્ધન ઈક્વિટેબલ ગીરો મિલકત રહેણાંક ફલેટ જે શ્રી જીતેન્દ્ર અથોકભાઈદરજીની માલીકી : એલઆઈજી-૧/ટી૧/૦૦૨, ૪૭૬ એલઆઈજી-૧, સાણંદ, અમદાવાદ, ગુજરાત, ટીપી સ્ક્રીમ નં. ૫, એફપી નં. ૧૬૩/૨ હુલ ઉપયોગી એરિયા ૩૫.૦૦ સ્કે. મીટર્સ, ચતુરસીમાઃ પૂર્વઃ માર્જીનલ ખૂલી જગ્યા, પશ્ચિમઃ પેસેજ, ફલેટ નં. ૦૦૩, ઉત્તરઃ ફલેટ નં. ૦૦૧, દક્ષિણઃ માર્જીન ખૂલી જગ્યા.

નોટીસ બજવણી માટેના અન્ય પગલાં લેવાઇ રહ્યા છે ઉપરોક્ત ઉદ્યારકર્તાને આથી આ નોટીસ પ્રસિદ્ધ થયાના ૬૦ દિવસની અંદર બાકી રકમની ચૂકવણી કરવા જણાવવામાં આવે છે. તેમા કસૂર થતાં આ નોટીસની તારીખથી ૬૦ દિવસ પૂરા થયા બાદ સિક્યુરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયસલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ,૨૦૦૨ ની કલમ ૧૩ની પેટા કલમ (૪) મુજબ આગળ પગલાં ભરવામાં આવશે. ૨૫ળઃ અમદાવાદ

MARG TECHNO-PROJECTS LIMITED

(CIN: L69590GJ1993PLC019764)
Reg, Office: 406, Royal Trade Centre, Opp. Star Bazaar, Adajan, Surat - 395009, Gujarat Contact: 99253 61689 Email: margtechno@gmail.com Website: www.margtechno.com

Particulars	Quarter ending /Current Year ending	Year to date Figures/Previous Year ending	Corresponding 3 months ended in the previous year	
	Quarter ended	Half Year Ended	Quarter ended	
	30-09-2023	30-09-2023	30-09-2023	
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	
Total income from operations (net)	132.17	249.27	139.97	
Net Profit / (Loss) from ordinary activities after tax	16.26	23.87	3.26	
Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)	16.26	23.87	3.26	
Equity Share Capital	600	600	600	
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)				
Earnings Per Share (before extraordinary items) (of` 10/- each)				
Basic :	0.27	0.40	0.05	
Diluted:	0.27	0.40	0.05	
Earnings Per Share (after extraordinary items) (of `10/- each)	0.27	0.40	0.05	
Basic :	0.27	0.40	0.05	
Diluted:	0.27	0.40	0.05	

ote. The above is an extract of the detailed format of financial results for the quarter ended September 30, 2023, filed with the Stock Exchanges under Regulation 33 and Regulation 52 of SEBI (Listing Obligation and Disclosure Requirements)
Regulations, 2015. The full format of financial results for the quarter and Half Year ended September 30, 2023 is available on Stock Exchange website (www.bseindia.com and www.msei.in) and on the website of the company (https://margtechno.com/).

For and on behalf of Board of Directors For MARG TECHNO-PROJECTS LIMITED Sd/- Akhil Nair Managing Director DIN: 07706503 Place: Surat

NPCL NOIDA POWER COMPANY LIMITED CIN: U31200UP1992PLC014506

Notice Inviting Bids for Procurement of Hydro Power with renewable benefit on Medium Term basis

Bids are invited by "Noida Power Company Limited having its registered office at Electric Sub-station, Knowledge Park-IV, Greater Noida - 201310 (U.P.)" for procurement of 100 MW hydro power with renewable benefit from 01.05.2024 to 30.09.2026 in accordance with Guidelines dated 30.01.2019 issued by Ministry of Power, GOI. Bid Document is available on DEEP Portal of www.mstcecommerce.com.

The Company reserves the right to reject all or any of the Bids or cancel the bidding process at any stage without assigning any reasons whatsoever and without any liability.

For any clarification, contact at e-mail id powertrading@noidapower.com or mobile no. 9718804966. Head (Power Purchase)

हैं के ऑफ़ बड़ौदा वरभाव शाजा : शोप लं. ७-९२, ગ્રાઉન્ડ ફલોર, 'બી' પ્લાઝ Bank of Baroda મો. 9687631248, ઇમેઇલ : dbvast@bankofbaroda.com

પરી લિષ્ટ-૩ - કબજાની નોટિસ - સ્થાવર મિલકતો માટે પ્રાથી નીચે સહી કરનાર **ોંક એફ બરો**કાના અધિકૃત અધિકારીશ્રીને સિક્યુરીટાઇફેશન એન્ ીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરૅસ્ટ એક્ટ, ૨૦૦૨ (બીજો) અને કલય ૧૩(૨) ની મળેલ સત્તાની રૂએ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એનફોરમિન્ટ) રૂલ, ૨૦૦૨ નાં રૂલ ૩ સાથે વાંચતાં તા. ૧૫.૦૪.૨૦૨૩ ના રોજ કિમાન્ક નોટીસે આપીને નીર્ જણાવેલ ઉદ્યારકર્તાઓને નીચે જણાવેલ બાકી રકમ આ નોટીસ મળ્યાના **૬૦ દિવસમાં** પરત ચુકવ

જણાવ્યું હતું. ઉધારકર્તાઓ સદર રકમ બેંકને પરત ચૂકવવામાં નિષ્ફળ ગયા ક્ષેવાથી ઉધારકર્તાઓ અને જાહેર જનતાને નોટીસ આપીને જણાવવામાં અવે છે કે આથી નીચે સહી કરનારે નીચે જણાવેલ મિલકતોનો ઉપર જણાવેલ કાયદાની કલમ ૧૩(૪) અને સિક્યુરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ ના રૂલ ૮ સાથે વાંચતા તેઓને મળેલ સત્તાની રૂએ તા. ૦૭.૧૧.૨૦૨૩ ના રોજ સાંકેતિક કબજો

લઈલીધો છે. આથી ઉધારકર્તાઓ/જામીનદારો/ગીરોમુકનારાઓ અને જાહેર જનતાને આથી ચેતવણી આપી જણાવવામાં આવે છે કે તેઓ સદર મિલકતો અંગે કોઈપણ વ્યવકાર ના કરે અને તેમ છતાં પણ કોઈ તેમ કરશે તો તેઓ બેંક ઓફ બરોડા પાસેથી નીચે જણાવેલ બાકી રકમ તથા નક્કી કરેલ દરે વ્યાજ, ચાર્જીસ અને ખર્ચાઓ સહિતની રકમ બેંકને ચૂકવવા સારૂ બંધનકર્તા રહેશે.

ઉદ્યારકર્તાઓને ખાસ ધ્યાન દોરવાનું કે સરફેસી કાયદાની કલમ ૧૩(૮) ની જોગવાઈ અનુસાર આપેલ સમયમર્થાદામાં કાયદાનુસાર તેમની સલામત મિલકત પાછી મેળવી શકે છે.

स्वायर मिलहतीनु यष्टान				
આનંદકુમાર પ્રજાપતિ અને	બાકી લ્હેસાં ર રૂા. ૧૩,૪૩,૮૫૪.૦૭ (રૂા. તેર લાખ તેતાળીસ હજાર આઠસો ચોપ્પન અને સાત પૈસા)			

મેલકતનો ખંઠ અને ભાગ બધું જ. રહેણાંક ફલેટ નં. ઈ/૫૦૧, પાંચમો માળ (મંજૂર પ્લાન મુજબ હોલો પ્લીન્થ ઉપર ચોથો માળ), દિવ્ય સૃષ્ટિ રેસેકિન્સી, કલ્પતરૂ રેસેકિન્સી પાસે, અધ્યાય રેસેકિન્સી સામે, વસ્ત્રાલ, અમદાવાદ–૩૮૨ ૪૧૮. સર્વે / બ્લોક નં. હ૪૯/૨, દીપીએસ નં ૧૧૪ (વસ્ત્રાલ – રામોલ), ઓ.પી. નં. ૧૦/૨, એક.પી. નં. ૧૦/૨, મૌજે વસ્ત્રાલ, અમદાવા ખાતે આવેલ મિલકત. જેની આજુબાજુ : પૂર્વમાં ફલેટ નં. ઈ/પ૦૨, પાસ્થિમમાં બિલ્કીંગનું માર્જીન, ઉત્તરમાં બિલ્કીંગનું માર્જીન અને રોક, દક્ષિણમાં લીફ્ટ, પેસેજ, સીકી અને ફલેટ નં. ઈ/પ૦૪.

બાકી લ્ફેણાં : રૂા. ७,૧૨,૭૩૩.૪૮ (રૂા. સાત લાખ શ્રી રમેશભાઈ શાંતિભાઈ ઠાકોર બાર કુજાર સાતસો તેત્રીસ અને અકતાળીસ પૈસા) મેલકતનો ખંડ અને ભાગ બધું જ. રહેણાંક ફલેટ નં. એમ/૧૦૨, પહેલો માળ, દેવનંદન સુપ્રિમસ, ગેલેલી ટાઉનશીપ પાસે, આરએએફ કેમ્પ સામે, એસ.પી. રીંગ રોઠ, વસ્ત્રાલ અમદાવાદ ૩૮૨૪૧૮. એન.એ. જમીન ઉપર આવેલ જેનો બ્લોક નં. ७ (રેવન્યુ સર્વે નં ૭७૩/૨), ક્ષેત્રફળ આશરે ૨७૯૨૩ ચો.મી. જેનો ટાઉન પ્લાર્નીંગ સ્ક્રીમ નં. ૧૧૪, ફાઈનલ પ્લોટ નં. ૩૦ / ર. ક્ષેત્રકળ આશરે ૧૬७૫૦ થો.મી. અને મૌજે વસ્ત્રાલ. આર.એસ.આર. નં. ૭७૩ / ર. ટીપી ૧૧૪, એફપી ૩૦/૨, તાલુકો અમદાવાદ, સીટી, કિસ્ટ્રીક્ટ અમદાવાદ સબ કિસ્ટ્રીક્ટ અમદાવાદ-७(ઓઢવ) ખાતે આવેલ મિલકત. જેની આજુબાજુ : ઉત્તરમાં ફ્લેટ નં. એમ/૧૦૫, દક્ષિણમાં સોસાથટીનો રોક, પૂર્વમાં ફલેટ નં. એમ/૧૦૧, પશ્ચિમમાં ફલેટ નં. એમ/૧૦૩.

ચીક મેનેજર અને અધિકત અધિકારી તારીખ : 06.૧૧.૨૦૨૩ સ્થળ : અમદાવાદ



AARVEE DENIMS AND EXPORTS LIMITED

Regd. Office: 191, Shahwadi, Nr. Old Octroi Naka, Narol-Sarkhej Highway, Narol, Ahmedabad-382 405. CIN NO: L17110GJ1988PLC010504 | Website: www.aarvee-denims.com | Email ID: info@aarvee-denims.com | Phone No: 079-68147000 | Fax No: 079-68147070

EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS (STANDALONE) FOR THE QUARTER & HALF YEAR ENDED SEPTEMBER 30, 2023

(₹ in Lakhs except for EPS)

		Standalone							
Sr	Particulars	Q	JARTER END	ED	HALF YEA	YEAR ENDED			
No.		SEPT 30,	JUNE 30,	SEPT 30,	SEPT 30,	SEPT 30,	MARCH 31,		
			2023	2022	2023	2022	2023		
			(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)		
1	Total income from operation		1,053.69	5,548.87	3774.35	16,586.32	26,357.60		
2	Net Profit/(Loss) for the period before tax and exceptional items	(1,826.30)	(2,702.07)	(2,863.26)	(4,528.37)	(4,195.09)	(9,667.09)		
3	Net Profit/(Loss) for the period before tax and after exceptional items	(1,826.30)	(2,702.07)	(2,863.26)	(4,528.37)	(4,195.09)	(9,667.09)		
4	Net Profit/(Loss) for the period after tax (after extra exceptional items)	(1,297.13)	(1,859.02)	(1,736.93)	(3,156.15)	(2,740.08)	(6,504.90)		
5	Equity share capital	2345.98	2,345.98	2,345.98	2345.98	2,345.98	2,345.98		
6	Total Comprehensive Income for the period [Comprising profit/(Loss) for the period after tax) and other Comprehensive income (after tax)]	(1,297.13)	(1,859.02)	(1,736.93)	(3,156.15)	(2,740.08)	(6,493.40)		
7	Reserves including Revaluation Reserve as shown in the audited balance sheet of the previous year	¥				*	3794.21		
8	Earnings per share (before and after extra ordinary items) (of Rs. 10/- each) Not Annualised Basic and Diluted	(5.53)	(7.92)	(7.40)	(13.45)	(11.68)	(27.54)		

- The above unaudited standalone financial results have been reviewed by the Audit Committee and subsequently have been taken on record by the Board of Directors at its meeting held on 10th November 2023
- 2 The above unaudited standalone financial results have been prepared in accordance with the guidelines issued by the Securities and Exchange Board of India ("SEBI") and the Indian Accounting Standards (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013.
- The limited review of unaudited standalone financial result for the quarter ended September 30, 20203 required in terms of clause 33 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 has been carried out by statutory auditors.
- Investors can view the unaudited standalone financial results of the company for the quarter ended September 30, 2023 on the company's website

www.aarveedenims.com or on www.bseindia.com and www.nseindia.com of the website of Bombay Stock Exchange ('BSE') and National Stock Exchange ('NSE') respectively.

Place: Ahmedabad Date: 10th November 2023

Vinod P. Arora Chairman and Managing Director (DIN: 00007065)

For, Aarvee Denims and Exports Limited



Advait Infratech Limited

CIN: L45201GJ2010PLC059878

Registered Office: A-801 to 803, Sankalp Iconic Tower, Iscon Temple Cross Road, S.G.Highway, Ahmedabad-380054. Phone: +91 079 4895 6677 • Email ID: cs@advaitinfra.com • Website: www.advaitinfra.com

Statement of Unaudited Finanical Results for the Quarter and Half year ended September 30, 2023 [₹ in Lakhs]

S.	Particulars 30t	Standalone					Consolidated				
		Quarter ended 30th September		Half Year ended 30th September		Year ended 31st March	Quarter ended 30th September		Half Year ended 30th September		Year ended 31st March
No.		2023 Unaudited	2022 Unaudited & Restated	2023 Unaudited	2022 Unaudited & Restated	2023 Audited & Restated	2023 Unaudited	2022 Unaudited & Restated	2023 Unaudited	2022 Unaudited & Restated	2023 Audited & Restated
1.	Total Income from Operations	4,797.87	2,793.82	7,522.02	3,706.84	10,306.66	4,894.83	2,800.36	7,640.41	3,773.42	10,420.52
2.	Profit/ (Loss) before exceptional and extraordinary items and taxes	665.17	317.42	869.61	482.72	1,353.42	716.55	244.19	921.24	412.52	1,197.28
3.	Profit / (Loss) before taxes (after exceptional and extra ordinery Items)	665.17	317.42	869.61	482.72	1,353.42	716.55	244.19	921.24	412.52	1,197.28
4.	Profit / (Loss) after taxes(after exceptional and extra ordinery Items)	498.45	243.64	637.72	375.47	1,000.09	549.83	170.41	689.35	305.27	843.96
5.	Total Comperhensive Profit/ (Loss) for the period	0.04	2.95	0.63	5.90	11.80	0.04	2.95	0.63	5.90	11.80
6	Equity Share Capital [Face value of Rs. 10/- each]	1,020.00	510.00	1,020.00	510.00	1,020.00	1,020.00	510.00	1,020.00	510.00	1,020.00
7.	Reserve [Excluding revaluation reserve]			13.54	•	4,182.65	-		3.50		3,564.35
8.	Basic Earning per share (In Rs.)	4.89	9.80	6.25	7.36	9.80	5.39	3.34	6.76	5.99	8.27
9.	Diluted Earning per share (In Rs.)	4.89	9.80	6.25	7.36	9.80	5.39	3.34	6.76	5.99	8.27
Not	es:	onerna serre minerale serenaria da							contas comentos octubro		

- The above is an extract of the details format of quarterly and half yearly ended financial results as on 30th september, 2023 filed with the Stock Exchange under regulations 33 of the SEBI [LODR] Regulations, 2015. The full format of the Financial Results are available on the Stock Exchange website [www.bseindia.com] and on the company website [www.advaitinfra.com].
- The company have adopted IndAS which are applicable form 1st April, 2023. Accordingly company's financial statements have been restated as on 31" March, 2023 as per The Indian Accounting Standard (IndAS), as notified under section 133 of The Companies Act, 2013.
- Figures have been re-grouped/re-classified to make them comparable to the figures wherever necessary.
- 4. The above unaudited results were reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 9th November, 2023 For and on behalf of the Board of Directors of

Advait Infratech Limited Shalin Sheth

Place: Ahmedabad Date: 11th November, 2023 Managing Director DIN: 02911544